

October 23, 2024

To,  
**BSE Limited,**  
Listing Department,  
P. J. Towers, Dalal Street,  
Mumbai - 400 001  
(Scrip Code : 500365)

Dear Sir/Madam,

**Subject : Newspaper Advertisement**

In accordance with the Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, please find attached herewith a copy of the newspaper publications with respect to the unaudited financial results for the quarter and half year ended September 30, 2024 published on October 23, 2024 in Financial Express (English) and Financial Express (Gujarati).

Please take the above information on the record.

Thanking You,

Yours faithfully,  
**For Welspun Specialty Solutions Limited**

**Suhas Pawar**  
**Company Secretary & Compliance Officer**  
**ACS- 36560**

Encl.: as above

**Welspun Specialty Solutions Limited**

Welspun House, 5th Floor, Kamala City, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai 400 013, India.

T: +91 22 6613 6000 / 2490 8000 | F: +91 22 2490 8020

E-mail: [companysecretary\\_wssl@welspun.com](mailto:companysecretary_wssl@welspun.com) | Website: [www.welspunspecialty.com](http://www.welspunspecialty.com)

Registered Address & Works: Plot No. 1, GIDC Industrial Estate, Valia Road, Dist. Bharuch, Jhagadia, Gujarat - 393110. India

Corporate Identity Number: L27100GJ1980PLC020358



**MUTHOOT HOUSING FINANCE COMPANY LIMITED**  
 Registered Office: TC NO.14/20747, Muthoot Centre, Punnen Road, Thiruvananthapuram - 695 034.  
 CIN NO - U65922KL2019PLC022624, Corporate Office: 12A/01, 13th floor, Parinane Crescendo, Plot No. C38 & C39, Bandra Kurla Complex-5 block (East), Mumbai-400051 TEL. NO: 022-62728517  
 Email Id: authorised.officer@muthoot.com

**APPENDIX-IV[Rule 8(1)] Possession Notice (For Immovable Property)**

Whereas the undersigned being the Authorized Officer of the Muthoot Housing Finance Company Ltd., under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI Act) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice to below mentioned Borrowers/ Guarantors, After completion of 60 days from date of receipt of the said notice, The Borrowers/ Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrowers/ Guarantors and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on them under section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this.

Sr. No.	LAN / Name of Borrower / Co-Borrower / Guarantor	Date of Demand notice	Total O/s Amount (Rs.) Future Interest Applicable	Date of Possession
1	LAN No. 11164073534 1. Aiyubsha Jabdalsa Diwan, 2. Yasinbanu Aiyubsha Diwan	22-May-2021	Rs.3,23,387.13/- as on 19-May-2021	20-October-2024

Description of Secured Asset(s)/ Immovable Property (ies): ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY BEARING WARD NO.6, C.S NO 2120, HOUSE NO 1706, DIWANWADO, CHAKLASI, GUJARAT, KHEDA, 387315, INDIA

The Borrowers/ Guarantors/in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Muthoot Housing Finance Company Limited, for an above mentioned demanded amount and further interest thereon.

Place: Gujarat, Date: 23 October, 2024  
 Sd/- Authorised Officer, For Muthoot Housing Finance Company Limited

**DICABS DIAMOND POWER INFRASTRUCTURE LIMITED**

**NOTICE FOR EXTRA ORDINARY GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE**

Notice is hereby given that the Extra Ordinary General Meeting (EGM) No. 01 / 2024-25 of the Company will be held on Friday, 15<sup>th</sup> November, 2024, at 11:00 A.M. (IST) through Video Conferencing / Other Audio Visual Means (VC / " OAVM") to transact the business, as set out in the Notice of EGM dated 18<sup>th</sup> October, 2024. The Company has sent the Notice convening EGM to the members whose email addresses are registered with the Company and/or Depositories as on 18th October, 2024.

The Company has sent the EGM Notice on Tuesday, October 22, 2024, through electronic mode to all the Members whose e-mail IDs are registered with the Company's Registrar & Share Transfer Agent, M/s. KFin Technologies Limited / Depository Participant (s) in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. As per the Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the members are provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of EGM using electronic voting system ("e-voting") provided by KFin Technologies Limited ("KFin"). The voting rights of Members shall be in proportion to equity shares held by them in the paid-up equity share capital of the Company as on Friday, November 8, 2024 ("cut-off date"). The Register of Members and Share Transfer Books will remain closed from Saturday, November 9, 2024 to Friday, November 15, 2024 (both days inclusive) for the purpose of Extra Ordinary General Meeting.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions which is set out in the Notice of the EGM. Members have the option to cast their vote on any of the resolutions using the remote e-voting facility or e-voting during the EGM. Detailed procedure for remote e-voting/e-voting during the EGM is provided in the Notice of the EGM. The remote e-voting period commences on Tuesday, November 12, 2024 (09:00 A.M. IST) to Thursday, November 14, 2024 (05:00 P.M. IST). The remote e-voting module shall be disabled thereafter by KFin. The Members who have cast their votes by remote e-voting on the resolutions prior to the EGM may attend/participate in the EGM through VC/OAVM but shall not be entitled to cast their votes on such resolutions again.

Any person holding shares in physical form and non-individual shareholders, who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as of the cut-off date, may obtain the user ID and password for casting his/her vote and for attending the EGM, by sending a request at evoting@kfintech.com. However, if he/she is already registered for remote e-voting then he / she can use his/her existing User ID and password for casting the vote.

Individual shareholders holding securities in dematerialized mode and who acquire shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as of the cut-off date may follow steps mentioned in the Notice of EGM. For details relating to remote e-voting, please refer to the Notice of EGM. In case of any query and/or grievance, in respect of voting by electronic means, Members may refer to the Help & Frequently Asked Questions (FAQs) and E-voting user manual available at the download section of https://evoting.kfintech.com (Kfintech Website) or contact Ms. C. Shobha Anand, at evoting@kfintech.com or call Kfintech's toll free No. 1-800-309-4001 for any further clarifications.

The Board of Directors have appointed Mr. Ashish Shah (Membership No.:5974) as the Scrutinizer to scrutinize the remote e-voting facility as well as e-voting facility during the EGM in a fair and transparent manner.

Helpdesk for Individual shareholders holding securities in dematerialized mode for any technical issues related to login through Depository i.e. NSDL and CDSC:

Login Type	Helpdesk details
Securities held with NSDL	Members facing any technical issue in login can contact NSDL Helpdesk by sending a request at e-voting@nsdl.com or call at 022-4886 7000.
Securities held with CDSC	Please contact CDSC helpdesk by sending a request at helpdesk.evoting@cdscindia.com or contact at Toll Free No. 1800225533
KFin Technologies Limited	Members facing any technical assistance or support before or during the EGM are requested to contact Kfintech at Toll Free No. 1-800-309-4001 or write to them at evoting@kfintech.com

The Notice convening the EGM is also available on the website of Company at www.dicabs.com and also on website of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and the website of agency providing e-voting facility i.e. www.kfintech.com

For Diamond Power Infrastructure Limited  
 Sd/-  
 Ahmedabad, 22<sup>nd</sup> October, 2024  
 Diksha Sharma - Company Secretary  
 Membership No.: 56317

Regd. Office: Phase II, Village Vadadala, Taluka - Savli, Vadodara - 391520  
 Tel: 0266-251345 / 251516 | E-mail: cs@dicabs.com  
 www.dicabs.com | CIN: L31300GJ1992PLC018198

**WELSPUN SPECIALTY SOLUTIONS LIMITED** Welspun SPECIALTY SOLUTIONS  
 CIN : L27100GJ1980PLC020358  
 Regd. Office : Plot No. 1, GIDC Industrial Estate, Valia Road, Jhagadia, Dist. Bharuch, Gujarat-393110  
 Website : www.welspunspecialty.com, Email ID : companysecretary\_wss@welspun.com

**EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND SIX MONTHS ENDED SEPTEMBER 30, 2024**

Sr. No.	PARTICULARS	(Rs. In Lacs)				
		Quarter Ended		Six Months Ended		Year Ended
		30.09.2024	30.09.2023	30.09.2024	30.09.2023	31.03.2024
1	Total Income from operations	17,298	21,353	34,101	37,982	71,817
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(635)	520	(375)	1,634	2,860
3	Net Profit/(Loss) for the period (after Tax, Exceptional and/or Extraordinary items)	(635)	520	(375)	1,634	2,860
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(635)	520	(440)	1,634	6,247
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(966)	649	(726)	1,939	6,371
6	Paid-up equity share capital (Rs.6/- per equity share)	31,805	31,805	31,805	31,805	31,805
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	(22,497)
8	Earnings Per Share (of Rs. 6/- each) (Not Annualised)	-	-	-	-	-
	Basic:	(0.12)	0.10	(0.08)	0.31	1.18
	Diluted:	(0.12)	0.10	(0.08)	0.31	1.18

Notes:  
 1. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on October 22, 2024.  
 2. The above is an extract of the detailed format of Financial Results for Quarter & Six months ended September 30, 2024 filed with stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the aforesaid Unaudited Financial Results is available on the Stock Exchange website of BSE at www.bseindia.com and company's website at www.welspunspecialty.com

For Welspun Specialty Solutions Limited  
 Sd/-  
 Anuj Burakia  
 CEO & Whole Time Director  
 DIN:02840211

Place: Mumbai  
 Date : October 22, 2024

**IEL LIMITED**  
 CIN: L15140GJ1956PLC124644  
 Reg. Off. : Shed No 15, Shyam Hari Industrial Estate, Phase 4, GIDC, Vatva, Ahmedabad - 382445, Gujarat, INDIA  
 Ph.: 079-40026095, Website: www.ielindia.in, E-mail: ielimitedam@gmail.com

**Extracts of Un-Audited Standalone Financial Results for the Quarter and Half Year ended 30<sup>th</sup> September, 2024**

Sr. No.	Particulars	Quarter ended					Year ended
		Quarter ended		Half Yearly		Quarter ended	
		30.09.2024	30.06.2024	30.09.2024	30.09.2023	30.09.2023	
1	Total Income from Operations	22.00	553.27	104.15	575.27	264.65	1726.21
2	Net Profit/Loss for the period (before Tax, exceptional and/or extraordinary items)	16.29	40.65	(4.93)	56.94	(98.71)	34.63
3	Net Profit/Loss for the period before Tax (after exceptional and/or extraordinary items)	16.29	40.65	(4.93)	56.94	(98.71)	34.63
4	Net Profit/Loss for the period after Tax (after exceptional and/or extraordinary items)	13.29	30.65	(4.93)	43.95	(100.46)	25.68
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-	-	-	-	-	-
6	Equity Share Capital	333.76	333.76	333.76	333.76	333.76	333.76
7	Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	(211.41)
8	Earnings per share (of Rs.10/- each) (not annualised)	-	-	-	-	-	-
	(a) Basic - in Rs.	0.040	0.092	(0.015)	0.132	(0.301)	0.077
	(b) Diluted in Rs.	0.040	0.092	(0.015)	0.132	(0.301)	0.077

The above is an extract of the detailed format of Un-Audited Standalone Financial Results for the Quarter and Half Year ended 30<sup>th</sup> September, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-Audited Standalone Financial Results for the Quarter and Half Year ended 30th September, 2024 are available on the Stock Exchange website i.e. www.bseindia.com and also the Company's website www.ielindia.in.

By Order of the Board  
 For IEL Limited  
 Ajaykumar Bholanath Gupta  
 Managing Director (DIN: 07542693)

Place: Ahmedabad  
 Date : 21/10/2024

**Equitas Small Finance Bank Ltd**  
 (FORMERLY KNOWN AS EQUITAS FINANCE LTD)  
 Corporate Office : No.769, Spencer Plaza, 4th Floor, Phase-II, Anna Salai, Chennai - 600002.  
 Branch Office: 305-306, 3rd Floor, Abhisree Adroit, Nr. Sunrise Mall, Mansi Circle, Judges Bungalow Road, Bodakdev, Ahmedabad, Gujarat - 380015.

**POSSESSION NOTICE**  
 (Rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)  
 (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of the EQUITAS SMALL FINANCE BANK LIMITED, Under The Securitization And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of The Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice Calling Upon the below mentioned Applicant /Borrower /Co-Applcant/ Co-Borrower/Guarantors/Mortgagors to repay the amount mentioned in the notice With subsequent interest, penal interest, charges, costs etc as per the agreement(s) within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Co-Borrower / Guarantors/ Mortgagors, having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrower/ Guarantors/ Mortgagors in particular and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said Rules.

The Applicant / Borrower / Co-Applcant/ Co-Borrower/Guarantors/ Mortgagors In Particular And The Public In General Is Hereby Cautioned Not To Deal With The Property And Any Dealings With The Property Will Be Subject To The Charge Of Equitas Small Finance Bank Limited, The Applicant / Borrower / Co-Applcant/Co-Borrower/Guarantors/ Mortgagors attention is invited to provisions of sub-section (8) of Section 13 of the said Act, in respect of time available, to redeem the secured assets.

SR NO	Name of the Borrower(s) / Guarantor(s)	Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date and Amount	Date of Possession
1	1. Mr. Gohil Shaileshkumar S/o Mr. Laxmansinh 2. Mrs. Gohil Parvatiben W/o Mr. Laxmansinh	<b>RESIDENTIAL PROPERTY OWNED BY MR. GOHIL SHAILESHKUMAR S/O LAXMANSINH &amp; MRS. GOHIL PARVATIBEN W/O LAXMANSINH</b> All that pieces and parcels of property bearing Plot No. A-202, Plot area measuring 60.04 sq. mtrs. (Plot with Construction) Project of "Kuber Residency" situated in land bearing Block/ R. S. No. 274/5 paiki 1/Paiki 1, C. S. No. NA 274/5 Paiki 1/Paiki 1/ 202 of Village. Halol, Ta. Halol, Dist. Panchmahal and bounded by: <b>Four corners of said property :- North : Plot No. B 202, South : 9.00 Mtr Road, East: Plot No. A 203, West: 6.00 Mtr Road</b>	27/06/2024 Rs. 20,93,601/- (Rupees Twenty Lakhs Ninety Three Thousand Five Hundred One Only) due as on 25/06/2024	19/10/2024
2	1. Mr. Vasava Mohanbhai S/o Mr. Chhaganbhai, 2. Mr. Vasava Bhupendrabhai S/o Mr. Rameshbhai	<b>RESIDENTIAL PROPERTY OWNED BY MR. VASAVA MOHANBHAI S/O CHHAGANBHAI</b> All that pieces and parcels of immovable property bearing Block No.138, Type-B, Plot area measuring 37.03 sq. mtrs. and Undivided share of land area measuring 27.96 sq. mtrs. Total area measuring 60.99 sq. mtrs., Ground Floor construction area measuring 26.56 sq. mtrs. & First Floor area measuring 29.46 sq. mtrs. in the scheme known as "WEST PART COUNTY" situated at Block/Survey No.1152. Old Block/Survey No.617 paiki 2 area measuring 30655 sq. mtrs. of Moje : Gutal, Registration Sub-District : Wagdhoda, District : Vadodara and bounded by: <b>Four corners of said property :- North : 9.00 Mtr Road, South : Plot No. B-137, East: Plot No. B-175, West : 7.50 Mtr Road</b>	27/06/2024 Rs.11,93,582.67/- (Rupees Eleven Lakhs Ninety Three Thousand Five Hundred Eighty Two And Sixty Seven Paise Only) due as on 25/06/2024	19/10/2024
3	1. Mr. Luhar Kamleshbhai Kanubhai S/o Mr. Kanubhai, 2. Mrs. Lular Sonalben Kamleshbhai W/o Mr. Kamleshbhai	<b>RESIDENTIAL PROPERTY OWNED BY MR. LUHAR KAMLESHBHAI KANUBHAI S/O MR. KANUBHAI &amp; MRS. LUHAR SONALBEN W/O KAMLESHBHAI</b> All that pieces and parcels of property bearing Plot No.23, Plot area measuring about 58.36 sq. mtrs., scheme known as "PRARABMIH" NA land situated land bearing Revenue Survey No. 2021/1, of Village. Kanjarj, Registration Sub District Halol, District : Panchmahal with all present and future structures thereon and bounded by: <b>Four corners of said property:- North : Plot No.24, South : Plot No. 21, East: Plot No.26, West : Road</b>	31/07/2024 Rs.11,08,597.7/- (Rupees Eleven Lakhs Eight Thousand Five Hundred Ninety Seven Only) due as on 20.07.2024	19/10/2024
4	1. Mr. Parmar Bharatkumar Govindbhai S/o Mr. Govindbhai, 2. Mr. Parmar Govindbhai S/o Mr. Natvarsinh	<b>RESIDENTIAL PROPERTY OWNED BY MR. PARMAR BHARATKUMAR GOVINDBHAI S/O. PARMAR GOVINDBHAI &amp; MR. PARMAR GOVINDBHAI S/O. NATVARSINH</b> All that pieces and parcels of property bearing Plot No.125, area measuring 55.00 sq. mtrs. (591.80 sq. ft.) in the scheme known as "Shradha Residency - 2" situated in land bearing Revenue Survey No.318, of Village. Sathrota, Ta. Halol, Dist. Panchmahal and bounded by: <b>Four corners of said property:- North : Plot No. 130, South : Road, East : Plot No. 126, West : Plot No. 124/1</b>	28/06/2024 Rs.15,93,609/- (Rupees Fifteen Lakhs Ninety Three Thousand Six Hundred Nine Only) due as on 27/06/2024	19/10/2024

Date - 19.10.2024  
 Place - Gujarat  
 Authorized officer  
 Equitas Small Finance Bank Ltd

**Canara Bank** Bodakdev Branch: SHOP NO. 6, 7, 8 & 9, Prime Plaza, Opp Dla School, Po : Bodakdev, Ahmedabad 380054  
 Phone No: 9427319895 Email: cb17037@canarabank.com

**DEMAND NOTICE [SECTION 13(2)] TO BORROWER/ GUARANTOR/MORTGAGOR**

Ref: AMRO/RL/BODAKDEV/2024-25 Date: 22/10/2024

To: M/S HIMANSHU ENGINEERING  
 Registered Factory: Plot No.620, Gidc Vatva Block Phase IV, Ahmedabad, Gujarat 382445

Proprietor: MR. KRISH HIMANSHUBHAI VARIA  
 C/1001 Ashvarti, Bih Karnavati Bunglows, Gandhinagar Sarkhej Highway, Nr. Ramdevnagar Chokdi, Satellite, Ahmedabad, Gujarat 380015 Also At, D-902 Aswari Tower, Nr Wide Angle Cinema, S G Highway, Satellite, Ahmedabad, Gujarat 380015

Mortgagor : Mrs. Chandrakanta Prfulchandra Varia  
 Guarantor W/o Prfulchandra, C-1001 Asavari Tower, Bih Wide Angle, Satellite, Ahmedabad City, Manekbag, Ahmedabad, Gujarat 380015

Dear Sir  
 Sub: Notice issued under Section 13(2) of the Securitisation & Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002.

You have availed following Loans / Credit Facilities from our Canara Bank Bodakdev branch from time to time:

Sl. No.	Loan No.	Nature of Loan/Limit	Principal as on date 22/10/2024	Interest and other charges as on date 22/10/2024	Total Liability as on date 22/10/2024	Rate of Interest (Inclusive of penal interest)
1	125004024596	MSME/OD/CC	3,99,96,357.28	2,13,781.00	4,02,10,138.28	13.65%
		<b>TOTAL</b>	<b>3,99,96,357.28</b>	<b>2,13,781.00</b>	<b>4,02,10,138.28</b>	

The above said loan/credit facilities are duly secured by way of mortgage of the assets more specifically described in the schedule hereunder, by virtue of the relevant documents executed by you in our favour. Since you had failed to discharge your liabilities as per the terms and conditions stipulated, the Bank has classified the debt as NPA on 22/10/2024. Hence, we hereby issue this notice to you under Section 13(2) of the subject Act calling upon you to discharge the entire liability of as on 22/10/2024, amounts to **Rs. 4,02,10,138.28 (Rupees Four Crore Two Lakh Ten Thousand One Hundred Thirty Eight and Paise Twenty Eight Only) + further interest and charges from 23/10/2024 in OOD account**, with accrued and up-to-date interest and other expenses, within sixty days from the date of the notice, failing which we shall exercise all or any of the rights under Section 13(4) of the subject Act.

Further, you are hereby restrained from dealing with any of the secured assets mentioned in the schedule in any manner whatsoever, without our prior consent. This is without prejudice to any other rights available to us under the subject Act and/or any other law in force. Your attention is invited to provisions of sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets. The demand notice had also been issued to you by Registered Post AD due to your last known address available in the Branch record.

**SCHEDULE**

The specific details of the assets Mortgaged are enumerated hereunder:

Sl.	Nature	Name of the title holder
1	Hypothecation of stocks & book debts kept at factory premises situated at Plot No.620, Gidc Vatva, Block Phase IV, Ahmedabad, Gujarat 382445 or any other place of the borrower <b>CERSAI Security Interest ID:</b> Stocks & Book debts: 400071459279	M/S Himanshu Engineering Through it's Proprietor Mr. Krish Himanshubhai Varia

**Details of Immovable Assets**

Sl.	Nature	Name of the title holder
1	All that piece or parcel of the land with building/premise bearing flat no. C/1001 on the 10th floor with penthouse, in the society known as Democratic co. operative housing society Ltd. Vibhag-2, in the scheme known as "Asavari" situated on land bearing old survey no. 996/2 paiki of vajapur and new survey no 323/2 paiki of Jodhpur, T.P. Scheme no.6, Final plot No. 161/2, 161/3, 161/4 & 163 situated lying and being at moje Village, Jodhpur, Taluka. City, and Registration District sub District at Ahmedabad-4 (Paldi) and the said property is bounded as follows: (As per sale deed) East: Open Plot of Asavari, West: wide angle cinema, North: Block no. 'D', South: Block no. 'C'-1002 Admesauri Undivided share in land: 25 sq. mtrs. Construction: 437.78 sq. mtrs. i.e. 520 sq. yds. Year of construction: 1998 Flat no C 1001, on tenth floor with penthouse in block-C, admesauri 520 sq. yard i.e. 434.78 sq.mtrs. area, and undivided share in land amtd. 25 sq. mtrs in the scheme known as 'Asavari' of Democratic Co Op Housing society limited Part-2. Survey/Block no 323/2 paiki Jodhpur, (Old survey no. 996/2 paiki Vajapur), TP Scheme no. 6, F.P. no. 161/2, 162/3, 161/4 and 163, village-Jodhpur, Taluka/Hobli -Vajapur, District-Ahmedabad. (As per mortgage deed) Municipal tenement no: 0627-19-1690-0001-T, Electricity Service no: 3130096 Boundaries: North: Block-D, South: Flat no. C-1002, East: Open Plot of Asavari, West: wide angle cine <b>CERSAI Security Interest ID:</b> 400071442338	Mrs. Chandrakanta Prfulchandra Varia

Date : 22.10.2024 Place : Ahmedabad  
 Authorised Officer CANARA BANK

**Canara Bank** Bhuj Branch

**DEMAND NOTICE [SECTION 13(2)] TO BORROWER/GUARANTOR/MORTGAGOR**

Ref: RORAJKOT/BHUJ/17121/TRILOK Date: 03/10/2024

To: Mr. Trilokram Ruparam Sharma (Borrower)  
 1. House No. 105, Survey No. 359, Bageshree Society - 4, Varsamedi, Anjar, Gujarat - 370110.  
 2. Plot No. 98, Revenue Survey No. 359, Bageshree Township - 4, Varsamedi Anjar, Kachchh, Gujarat - 370110.  
 Mr. Rajesh Shankar Lal Sharma (Guarantor)  
 Plot No. 261 and 262, Bageshree Township - 5, Varsamedi, Anjar, Gujarat - 370110.

Dear Sir / Ma'm,  
 Sub: Notice issued under Section 13(2) of the Securitisation & Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002.

That Mr. Trilokram Ruparam Sharma, Mr. Rajesh Shankar Lal Sharma has availed the following loans/credit facilities from our Bhuj Branch from time to time:

SR No	Loan No.	Loan Amount	Total Liability as on 03.10.2024	Rate of Interest
1	2884619000023	Rs. 13,00,000.00	Rs. 11,97,267.75	8.75%+2% (penalty interest)=10.75%

The above said loan/credit facilities are duly secured by way of mortgage of the assets more specifically described in the schedule hereunder, by virtue of the relevant documents executed by you in our favour. Since you had failed to discharge your liabilities as per the terms and conditions stipulated, the Bank has classified the debt as NPA on 01.10.2024. Hence, we hereby issue this notice to you under Section 13(2) of the subject Act calling upon you to discharge the entire liability of Rs. 11,97,267.75 (Rupees Eleven Lakh Ninety Seven Thousand Two Hundred Sixty Seven and Paise Seventy Five Only) as on 03.10.2024 with interest, incidental expenses, costs and other charges thereon from 04.10.2024 within sixty days from the date of the notice, failing which we shall exercise all or any of the rights under Section 13(4) of the subject Act. Further, you are hereby restrained from dealing with any of the secured assets mentioned in the schedule in any manner whatsoever, without our prior consent. This is without prejudice to any other rights available to us under the subject Act and/or any other law in force. Your attention is invited to provisions of sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets. The demand notice had also been issued to you by Registered Post Ack due to your last known address available in the Branch record.

**SCHEDULE**

The specific details of the assets Mortgaged are enumerated hereunder:

Mortgaged Assets	IMMOVABLE PROPERTY
Mortgaged	Property Bearing at Plot No. 98, Revenue Survey No. 359, Bageshree Township-4, Vill. Varsamedi, Tal. Anjar, Dist. Kachchh, Gujarat - 370110. Holder Name : Mr. Trilokram Ruparam Sharma. Admeasuring 91.98 Sq. Mtr. Boundary : North : Plot No. 99, South : Plot No. 97, East : 9.14 Mtr wide Internal Road, West : 1.52 Mtr Lane & then Garden & Park Plot No.01

Date : 23.10.2024, Place : Bhuj  
 Authorised Officer, Canara Bank

**Canara Bank** Bhachau Branch

**DEMAND NOTICE [SECTION 13(2)] TO BORROWER/GUARANTOR/MORTGAGOR**

Ref: RORAJKOT/BHACHAU/6482/RINKUKUNNU Date: 08/10/2024

To: Mrs. Rinku Devi (Borrower)  
 Plot No. 18/a, Ambaji 02, S. No. 890/19, Varsamedi, Anjar, Gujarat - 370110.  
 Mrs. Rinku Devi (Borrower) W/o Kunnu Upadhyay,  
 H. No. 1080, Near Dundahehra Chok, Industrial Complex, Dundahehra, Gurgaon, Haryana - 122016.  
 Mr. Kunnu Upadhyay (Co-Borrower)  
 Plot No. 18/a, Ambaji 02, S. No. 890/19, Varsamedi, Anjar, Gujarat - 370110.

Dear Sir / Ma'm,  
 Sub: Notice issued under Section 13(2) of the Securitisation & Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002.

That Mrs. Rinku Devi And Mr. Kunnu Upadhyay has availed the following loans/credit facilities from our Bhachau Branch from time to time:

SR No	Loan No.	Loan Amount	Total Liability as on 08.10.2024	Rate of Interest
1	6482630000079	Rs. 7,50,000.00	Rs. 4,34,569.78	8.95%+2% (penalty interest)=10.95%

The above said loan/credit facilities are duly secured by way of mortgage of the assets more specifically described in the schedule hereunder, by virtue of the relevant documents executed by you in our favour. Since you had failed to discharge your liabilities as per the terms and conditions stipulated, the Bank has classified the debt as NPA on 06.10.2024. Hence, we hereby issue this notice to you under Section 13(2) of the subject Act calling upon you to discharge the entire liability of Rs.4,34,569.78 (Rupees Four Lakh Thirty Four Thousand Five Hundred Sixty Nine and Paise Seventy Eight Only) as on 08.10.2024 with interest, incidental expenses, costs and other charges thereon from 08.10.2024 within sixty days from the date of the notice, failing which we shall exercise all or any of the rights under Section 13(4) of the subject Act. Further, you are hereby restrained from dealing with any of the secured assets mentioned in the schedule in any manner whatsoever, without our prior consent. This is without prejudice to any other rights available to us under the subject Act and/or any other law in force. Your attention is invited to provisions of sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets. The demand notice had also been issued to you by Registered Post Ack due to your last known address available in the Branch record.

**SCHEDULE**



WELSPUN SPECIALTY SOLUTIONS LIMITED						
CIN : L27100GJ1980PLC020358						
Welspun SPECIALTY SOLUTIONS						
Regd. Office : Plot No. 1, GIDC Industrial Estate, Valia Road, Jhagadia, Dist. Bharuch, Gujarat-393110						
Website : www.welspunspecialty.com, Email ID : companysecretary_wssl@welspun.com						
EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS						
FOR THE QUARTER AND SIX MONTHS ENDED SEPTEMBER 30, 2024						
Sr. No.	PARTICULARS	(Rs. In Lacs)				
		Quarter Ended	Quarter Ended	Six Months Ended	Six Months Ended	Year Ended
		30.09.2024/30.09.2023	30.09.2024/30.09.2023	30.09.2024/30.09.2023	30.09.2024/30.09.2023	31.03.2024
		Un-Audited	Un-Audited	Un-Audited	Un-Audited	Audited
1	Total Income from operations	17,298	21,353	34,101	37,982	71,817
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(635)	520	(375)	1,634	2,860
3	Net Profit/(Loss) for the period (after Tax, Exceptional and/or Extraordinary Items)	(635)	520	(375)	1,634	2,860
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(635)	520	(375)	1,634	2,860
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(966)	649	(726)	1,939	6,371
6	Paid-up equity share capital (Rs.6/- per equity share)	31,805	31,805	31,805	31,805	31,805
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year					(22,497)
8	Earnings Per Share (of Rs. 6/- each) (Not Annualised)	(0.12)	0.10	(0.08)	0.31	1.18
	Diluted:	(0.12)	0.10	(0.08)	0.31	1.18

Notes:  
1. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on October 22, 2024.  
2. The above is an extract of the detailed format of Financial Results for Quarter & Six months ended September 30, 2024 filed with stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the aforesaid Unaudited Financial Results is available on the Stock Exchange website of BSE at www.bseindia.com and company's website at www.welspunspecialty.com

For Welspun Specialty Solutions Limited  
Sd/-  
Anuj Burakia  
CEO & Whole Time Director  
DIN:02840211

Place: Mumbai  
Date : October 22, 2024

## ઇન્ડિયન ઓવરસીઝ બેંક

કાલુપુર સર્કલ બા-૫ અમદાવાદ, બીએસએનએલ બિલ્ડિંગ, કાલુપુર રેલવે સ્ટેશનની સામે, રેલવેપુરા, કાલુપુર અમદાવાદ ૩૮૦૦૦૧ ગુજરાત

ઈ-મેઇલ: job0003@job.in; વેબસાઇટ: www.job.in; મોબાઇલ - 8925950003

સ્થાયર મિલકતોના વેચાણ માટે ઇ-હરાજ માટે જાહેર નોટિસ

સિદ્ધાંતવિદ્યાવેદન એન્ડ રિસર્ચ-કેન્સર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિદ્ધાંતવિદ્યાવેદન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રા. લિ. ઇન્ડિયન ઓવરસીઝ બેંકને ગીરવે મુકદ્દી સ્થાયર મિલકતોનું વેચાણ, સુરક્ષા વિત (એન્ફોર્સમેન્ટ) નિયમો 2002 ના નિયમ 8(1)ના પરિચય સાથે વ્યાજવ્યાપી આવે છે. આથી સામાન્ય રીતે અને ખાસ કરીને ફાઇનાન્સિયલ એન્ડ ઇન્ફોર્સમેન્ટ ટેકનોલોજી સિદ્ધાંતવિદ્યાવેદન એન્ડ ઇન્ફોર્સમેન્ટ ટેકનોલોજી પ્રા. લિ. ઇન્ડિયન ઓવરસીઝ બેંકને ગીરવે મુકદ્દી સ્થાયર મિલકતોનું વેચાણ, સુરક્ષા વિત (એન્ફોર્સમેન્ટ) નિયમો 2002 ના નિયમ 8(1)ના પરિચય સાથે વ્યાજવ્યાપી આવે છે. જેનો પ્રકાશનકર્તા ઇન્ડિયન ઓવરસીઝ બેંકના અધિકૃત અધિકારી, સિદ્ધાંતવેદન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે, જે "જેમ છે ત્યાં" "જેમ છે તેમ" અને "જે કંઈ પણ" હોય તેના આધારે ૨૯.૧૧.૨૦૨૪ ના રોજ લેવામાં આવશે. ૨૧-૧૦-૨૦૨૪ ના રોજ ૧,૨૨,૨૨,૦૭૩.૪૫ (રૂપિયા એક કરોડ બેસાઈ લાખ બેસાઈ હજાર ત્રીસ અને પચાસી પૈસા પુરા) ની વચૂકાત માટે, ગેરેટર મેસર્સ સોલેક અર્થમાર્કેટ પ્રા. લિ. અને ગીરવે મુકદ્દી શ્રીમતી ડોડીયા ચંદ્રિકાબેન ધીરજીભાઈ શ્રી ડોડીયા જીનીયા ધીરજીભાઈ સ્થાયર મિલકતનું વર્ણન

ક્રમ નં.	યુગ્મધર્મ વિગતો	અનામત કિંમત	EMD	કબજાતી પ્રકાર
1.	રેસિડેન્સિયલ ફ્લેટ બ્લોક નંબર સી. ફ્લેટ નં. 4/સી/101, હોલ બિન-સ્થાયી ઉપર પ્રથમ માળ, (સાઈડ ૬ ફ્લેટ પર એકાદ ફ્લેટ નં. 4/એક/101 દ્વારા મંજૂર કરાયેલ યોજના મુજબ), "શ્રી બાલાજી વિન્ડપાર્ક" તરીકે ઓળખાતી ઉપસ્થાપિત, "શ્રી બાલાજી વિન્ડપાર્ક"ની સામે, ગાલા સેલેક્શનની સામે, એસ પી રિંગ રોડ, ખોજ, ગાંધીનગર -382421 આશરે 4000 ચોરસ ફુટ એટલે કે 372 ચોરસ મીટર સુપર બિલ્ડ અપ એરિયા અને 940.80 ચોરસ ફુટ એટલે કે 87.43 ચોરસ મીટર જમીનમાં અવિભાજિત હિસ્સા ધરાવતી આ ઇમારતનો વિસ્તાર છે.	૩, 1,77,52,000/- (1% આવકવેરા સહિત)	૩, 17,75,200/-	સંકેતિત

ઇ-હરાજની તારીખ અને સમય: 29.11.2024 અને સવારે 11.00 બેઠા 01.00 વાગ્યા સુધી  
વિલકત નિરીક્ષણની તારીખ અને સમય: 15.11.2024 અને સવારે 11.00 બેઠા 01.00 વાગ્યા સુધી

જાણીતા એન્જિનિયર-સ્વ. જી કોઈ હોય તો બેંકના જ્ઞાન મુજબ શુ-૫ બેંકના બાકી લેણાં વૈધાનિક બાકી લેણાં પર અગત્ય ધરાવે છે વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરવીને સુરક્ષિત ફેડિટરની વેબસાઇટ એટલે કે www.job.in અને ઇ-હરાજ સેવા પ્રદાતાના વેબ પોર્ટલમાં પૂરી પડવામાં આવેલી લિંકને જુઓ: https://ehkraj.in.

તારીખ: 23.10.2024, નાઇ: (વિલાદ ની સ્થિતિમાં અંગ્રેજી અનુવિન માન્ય રાખવામાં આવશે)  
સ્થળ: અમદાવાદ, સ્થાયર મિલકતનું વર્ણન

## ભારતીય સ્ટેટ બેંક

RACPC ઝોનલ ઓફીસ. સી.એન.વિદ્યાલય કેમ્પસ, આંબાવાડી, પી.બી. નં. ૧૧, અમદાવાદ-૩૮૦ ૦૧૫.

## સિદ્ધાંતવિદ્યાવેદન (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૧) હેઠળ કબજા નોટિસ

આથી જાણ કરવામાં આવે છે કે સિદ્ધાંતવિદ્યાવેદન એન્ડ રિસર્ચ-કેન્સર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિદ્ધાંતવિદ્યાવેદન એન્ડ ઇન્ફોર્સમેન્ટ ટેકનોલોજી પ્રા. લિ. ઇન્ડિયન ઓવરસીઝ બેંકને ગીરવે મુકદ્દી સ્થાયર મિલકતોનું વેચાણ, સુરક્ષા વિત (એન્ફોર્સમેન્ટ) નિયમો 2002 ના નિયમ 8(1)ના પરિચય સાથે વ્યાજવ્યાપી આવે છે. જેનો પ્રકાશનકર્તા ઇન્ડિયન ઓવરસીઝ બેંકના અધિકૃત અધિકારી, સિદ્ધાંતવેદન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે, જે "જેમ છે ત્યાં" "જેમ છે તેમ" અને "જે કંઈ પણ" હોય તેના આધારે ૨૯.૧૧.૨૦૨૪ ના રોજ લેવામાં આવશે. ૨૧-૧૦-૨૦૨૪ ના રોજ ૧,૨૨,૨૨,૦૭૩.૪૫ (રૂપિયા એક કરોડ બેસાઈ લાખ બેસાઈ હજાર ત્રીસ અને પચાસી પૈસા પુરા) ની વચૂકાત માટે, ગેરેટર મેસર્સ સોલેક અર્થમાર્કેટ પ્રા. લિ. અને ગીરવે મુકદ્દી શ્રીમતી ડોડીયા ચંદ્રિકાબેન ધીરજીભાઈ શ્રી ડોડીયા જીનીયા ધીરજીભાઈ સ્થાયર મિલકતનું વર્ણન

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૬, ઓપી માળ, મહાનગર નગર ઓ એમ, હાલિંગ સોસાયટી લી. વિમાન - ૬ કે જે ઈન્ટિગ્રેટેડ એન્કોમિટિડ વર્કી ઓળખાય છે. બેન્કિંગ સર્વિસ, ડટ અને ડટ (એવરપુલ) નું સર્વિસ નં. ૧૪૨ + ૧૪૩), ટી.બી. સ્ક્રીમ નં. ૨, ફાઇનલ પોલ્ટ - ૩/૩ ક્લેરિફાઇડ અમદાવાદ (પાલડી) સબ રિજિસ્ટ્રાર ડિવિઝન અમદાવાદ. સિદ્ધાંતવેદન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ છે. સોસાયટી સેલ્ટ દર્શિયા તરફ: કોમન જવાબ: પૂર્વ તરફ: ફ્લેટ નં. ૩/૬/૩૧. પૂર્વ તરફ: કોમન ટેલર: ફ્લેટ નં. ૩/૩૧. પશ્ચિમ તરફ: કોમન સીડી

ફ્લેટ નંબર સી/૧૦૨, (ઓ માળ), સામાન્ય નિર્માણ સેલેક્ટ, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

ફ્લેટ નંબર સી/૧૦૨, (ઓ માળ), સામાન્ય નિર્માણ સેલેક્ટ, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ ડિવિઝન અમદાવાદની અવિભાજિત જમીનની માલિકી. વચુકાત: ઉત્તર તરફ: સામે પુલ્કી જગ્યાવાર ૨૪ મીટર પહોળો ટી.બી. રોડ, દર્શિયા તરફ: સુબિન નં. સી/૦૧૦ ની તરફ પુલ્કી જગ્યાવાર

તમામ ભાગ અને પાર્સલ ધરાવતી મિલકત ફ્લેટ નં. ૩/૧૦૩, (પાર્સ માળ, બ્લોક નં. ૩), મીમ રેસિડેન્સી, બ્લોક નં. ૪૬૬/એ, ફાઇનલ પોલ્ટ નં. ૧૬૪/૨ ટીપી સ્ક્રીમ નં. ૨, (છુપા) ધરાવતી મિલકતના તમામ હસ્તાક્રમ અને પાર્સલ ૫૮.૦૦ ચોરસ મીટર, સોન ઓરિયા ૨.૧૦ ચોરસ મીટર અને ૨૫.૩૦ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. સબ રિજિસ્ટ્રાર વિલ્ડા અમદાવાદ-૯ (ઓપલ માં મોજે - છુમા, તાલુકો - દક્કોર સબ